



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૪/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૩૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૨ કેસ કરી, ૬૮ વ્યક્તિઓને ઝડપી, ૩૯૭ લીટર દેશી દારૂ, ૧૯૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૮ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧ કાર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૭ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૩૦,૪૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૩૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૭૩૭/૧૯

વસ્ત્રાપુર : ધર્મેન્દ્રસિંહ ભાગ્યવતસિંહ સોઢા (ઉ.વ.૩૨)(રહે.સંગમ એપાર્ટમેન્ટ શીલજ સર્કલ પાસે શીલજ) એ તા.૨૭/૪/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૪/૦૪/૨૦૧૯ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન (૧) સુમીત અને (૨) શુભમ કરૂણાશંકર દ્રીવેદી (રહે.બુધ્ધ વિહાર બદરપુર દક્ષિણ દીલ્લી) એ ભેગામળી બજાજ ફાયનાન્સ કંપનીના નામે લોન કરી આપવાનું કહી સાહેદ કિશોરકુમાર નો વિશ્વાસ કેળવી, ધર્મેન્દ્રસિંહ ની “ઇઝી પે પ્રાઇવેટ લી.કંપનીના ખાતામાં રૂપિયા ૨૫,૦૦૦/- જમા કરાવી તેમજ બીજા રૂપિયા ૩૦,૮૦૦/- તેમના ઓળખીતાના ખાતામા જમા કરાવડાવી, તે નાણા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી સાહેદ કિશોરકુમાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એચ.રાવલ ચલાવે છે.

શાહીબાગ : ચન્દ્રશેખર ઓમપ્રકાશ મિશ્રા (ઉ.વ.૫૫)(રહે. પાર્ક એવન્યુ ફ્લેટ, સોનાકોસ રોડ ન્યુ સી.જી.રોડ ચાંદખેડા)એ તા.૨૭/૪/૧૯ નારોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૮/૨૦૧૭ ના ૧૦/૦૦ વાગ્યાના સુમારે શાહીબાગ અસારવા મીલ ખાતે આરોપી ઇશિત મહેતા (રહે.સિધ્ધિ વિનાયક ટાવર, એસ.જી.હાઇવે, મકરબા) એ “ઉડુ કંપનીનું લાયસન્સ વર્ઝન સોફ્ટવેર આપવાનું જણાવી, તેના બદલે “ઉડુ કંપની” નું ઓનલાઇન ફી હોય તે વર્ઝન આપી તેમજ સોફ્ટવેર નાખવાના બદલે ચેકો મારફતે કુલ રૂપિયા ૧૧,૭૬,૦૪૦/- મેળવી લઇ, ચન્દ્રશેખર મિશ્રા સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.બી.ગોહીલ ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૭૩૮/૧૯

ચાંદખેડા : પુખરાજ જાલીરામ સુથાર (ઉ.વ.૨૪) (રહે. કૃષ્ણપાર્ક સોસાયટી, ચાણક્યપુરી ગોતા) એ તા.૨૭/૪/૧૯ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૪/૨૦૧૯ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે તેમના મિત્ર સાથે વંદેમાતરમ રોડ ગણેશ જેનીશી નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન બે પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ ચાર પુરૂષો એ ભેગામળી પુખરાજના પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂપિયા ૩૦,૦૦૦/- તથા ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- તેમજ અગત્યના દસ્તાવેજો મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦/- મતાની લુંટ કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.કે.પટેલ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૭૩૯/૧૯

એરપોર્ટ : જમનાદાસ ચંદીરામ અંજવાણી (ઉ.વ.૪૯)(રહે.પુષ્કર હોમ્સ નવનીત પાર્ટી પ્લોટ સામે નોબલનગર રોડ નાના ચીલોડા) એ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૪/૨૦૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે નોબલ ટર્નીંગ સુભાષનગર કિષ્ણાકૃપા કોલ્ડ્રીક નામની દુકાન સામે રોડ ઉપર પોતાની એક્ટીવામાં ચાવી ભરાવેલી રાખી દુકાને સોડા લેવા ગયેલ દરમ્યાન કોઈ અજાણી વ્યક્તિ એક્ટીવાની ડેકીમાંથી રોકડ રૂપિયા ૫૦,૦૦૦/-, બેંકની ચેકબુક તથા દુકાનની ચાવી સાથેનું પર્સ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી ડી.બી.પ્રજાપતી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.